

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન સીટીની એક્સેસિબલ સગવડોની ઝાંખી કરાવવા AccessNow (એક્સેસ-નાઉ) સાથે ભાગીદારી કરે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 8, 2022) – સીટી ઓફ બ્રેમ્પટને સમુદાયમાં સીટીની એક્સેસિબલ (પ્રવેશ સુલભ) સગવડોની ઝાંખી કરાવવા AccessNow સાથે ભાગીદારી કરી છે.

બ્રેમ્પટન એક રચના (મોઝેઈક) છે, અને સીટી પ્રવેશ સુલભતા વધારવા અને બધાં માટે મજબૂત સમજ કેળવવાની તકો ઓળખી કાઢવા સમર્પિત છે. AccessNow એપ Google Play (ગૂગલ પ્લે) અને Apple App Store (એપલ એપ સ્ટોર) પર ઉપલબ્ધ છે જે વપરાશકારોને દુનિયાભરના 35 દેશોમાં 26,000 થી વધારે એક્સેસિબલ અને એક્સેસિબલ સિવાયના પિન કરેલા સ્થળો શોધવાની છૂટ આપે છે. રહેવાસીઓ આ ભાગીદારીથી, ટ્રેઈલ્સ (પગદંડીઓ), પાર્ક્સ, રિક્રિએશન સેન્ટર્સ અને ઘણી સહિતની સીટીની પ્રવેશ સુલભ સગવડો શોધવામાં, ક્રમાંકન કરવામાં અને લક્ષમાં લેવામાં સક્ષમ બનશે.

રહેવાસીઓ AccessNow એપ પર સ્થાનિક રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, દુકાનો અને આકર્ષણો શોધવામાં, ક્રમાંકન કરવામાં અને લક્ષમાં લેવામાં સક્ષમ બનશે. બ્રેમ્પટનના ધંધાઓને પોતાની એક્સેસિબિલિટી (પ્રવેશ સુલભતા) માહિતી એપમાં [અહીં](#) ઉમેરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

બ્રેમ્પટનમાં એક્સેસિબિલિટી

સીટી અને તેની [એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી](#) બધી ઉંમરની અને ક્ષમતાઓ ધરાવતા લોકો બ્રેમ્પટનમાં રહે, કામ કરે, રમતો રમે, મુલાકાત લે અને રોકાણ કરે ત્યારે તેઓને સરખી તકો મળી રહે તેની ખાતરી કરાવવા કટિબદ્ધ છે. સીટીમાં પ્રવેશ સુલભતા પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/ceerp

AccessNow

AccessNow (એક્સેસ-નાઉ) એક મોબાઈલ એપ અને વેબસાઈટ છે જે દુનિયાભરના સ્થળોની એક્સેસિબિલિટી સ્થિતિ વિશે માહિતી વહેંચે છે. અક્ષમ લોકોને સશક્ત બનાવવા ડિઝાઈન કરેલું, આ પ્લેટફોર્મ ક્રાઉડસોર્સિસની સમીક્ષા કરે છે અને એક્સેસિબલ પાર્કિંગ અને વોશરૂમ્સ, એલિવેટર્સ, રેમ્પ્સ, સુગંધ-મુક્ત, શાંત જગ્યાઓ, અને ઘણી બધી જેવી એક્સેસિબિલિટીના પાસાઓ પ્રકાશિત કરવા ધંધાના માલિકો સાથે કામ કરે છે. વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.accessnow.com.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન એક રચના (મોઝેઈક) છે, અને સીટી પ્રવેશ સુલભતા વધારવા અને આપણાં વૈવિધ્યસભર સમુદાયમાં સૌ માટેની સુદૃઢ સમજ કેળવવાની તકો ઓળખી કાઢવા સમર્પિત છે. હું બ્રેમ્પટનવાસીઓને AccessNow એપ ડાઉનલોડ કરીને સીટીની આપણી સગવડોમાં ઉપલબ્ધ એક્સેસિબિલિટી લાક્ષણિકતાઓ લક્ષમાં લઈ શકે છે, અને આપણી સગવડોનું ક્રમાંકન કરી શકે છે જેથી કરીને આપણે સૌ માટે એક્સેસિબિલિટી સુધારવા કામ કરવાનું ચાલુ રાખી શકીએ છીએ. સાથે મળીને, આપણે બધી ક્ષમતાઓ ધરાવતા લોકો માટે વધારે સર્વગ્રાહી સમુદાય બનાવવાનું ચાલુ રાખી શકીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રમ્પટન અને રીજીયન ઓફ પીલ્સ એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટીસના સભ્ય તરીકે, આપણું શહેર આપણાં સમુદાયને વધારે પ્રવેશ સુલભ અને બધાં માટે સમાવેશ યોગ્ય બનાવવા જે કામ કરી રહ્યું છે તે માટે હું સતત ગૌરવ અનુભવું છું. AccessNow એપ આપણાં આખા શહેરમાં પ્રવેશ સુલભ સગવડો શોધવા, ક્રમાંકન કરવા અને લક્ષમાં લેવા એક ચડિયાતું સાધન (ટૂલ) છે. હું બ્રમ્પટનના ધંધાઓને એપમાં પોતાની માહિતી ઉમેરવા, અને રહેવાસીઓને એપ ડાઉનલોડ કરીને લક્ષમાં લેવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ ફોર્ટિની (Pat Fortini), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; સભ્ય, સીટી ઓફ બ્રમ્પટન એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી;
સભ્ય, રીજીયન ઓફ પીલ એક્સેસિબિલિટી એડવાઈઝરી કમિટી

“સીટી ઓફ બ્રમ્પટનમાં, અમે કાઉન્સિલની અગ્રતાની પરિભાષાને આગળ વધારવા સમર્પિત છીએ. બ્રમ્પટન એક મોજેઈક છે, અને બધી ઉંમરના અને ક્ષમતાઓ ધરાવતા લોકો આવકાર્ય અને સમાવેશી હોવાની લાગણી કરાવવાની ખાતરી કરાવે છે. સીટી આપણાં સમુદાયમાં પ્રવેશ સુલભ સગવડોની ઝાંખી કરાવવા AccessNow સાથે ભાગીદારી કરવામાં શેમાં અનુભવે છે, અને આપણાં રહેવાસીઓ માટે પ્રવેશ સુલભતા વધારવાની તકો ઓળખવાનું ચાલુ રાખશે.”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઇન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રમ્પટન

“AccessNow માં, અમે નાગરિકો અને મુલાકાતીઓ માટે શહેરની પ્રવેશ સુલભતાની ઝાંખી કરાવવા સીટી ઓફ બ્રમ્પટન સાથે ભાગીદારી કરવામાં ગૌરવ અનુભવીએ છીએ. સીટી, AccessNow અને વિશાળ સમુદાય વચ્ચેનો સહયોગ આગેવાની અને સહયોગીતાનું જબરદસ્ત ઉદાહરણ છે જેને મ્યુનિસિપાલિટી અક્ષમ લોકોને વધારે સારી સહાયતા કેવી રીતે કરી શકે છે તેની પર પ્રેરણા મેળવવા અન્ય લોકોએ એપ જોવી જોઈએ.”

- માયાન ઝિવ (Maayan Ziv), સ્થાપક અને CEO, AccessNow

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ , અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca